

પ્રથમ વર્ષ બેચલર ઓફ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી (બી.સી.ટી.) તેમજ બેચલર ઓફ ઇન્ટીરીઅર ડિઝાઇન (બી.આઈ.ડી.) અભ્યાસક્રમો માં ઓનલાઇન રાઉન્ડ અંતે સ્વનિર્ભર સંસ્થા (સેપ્ટ યુનિવર્સિટી) ખાતે ખાલી પડેલી બેઠકો ઉપર પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો માટેનો કાર્યક્રમો - વર્ષ-૨૦૨૦.

પ્રથમ વર્ષ ૨૦૨૦ માં બેચલર ઓફ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી (બી.સી.ટી.) તેમજ બેચલર ઓફ ઇન્ટીરીઅર ડિઝાઇન (બી.આઈ.ડી.) અભ્યાસક્રમોની ઓફ લાઇન પ્રવેશ પ્રક્રિયા તા. ૨૭/૧૦/૨૦૨૦ ના રોજ પૂર્ણ થયેલ છે.

સદર પ્રક્રિયા બાદ ખાલી રહેલી બેઠકો શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યનાં પ્રવર્તમાન જાહેરનામાં મુજબ ભરવાની થાય છે. જેનાં અનુસંધાને સ્વનિર્ભર સંસ્થા (સેપ્ટ યુનિવર્સિટી-CEPT) ખાતે ખાલી રહેલી બેઠકોની માહિતી પ્રવેશ સમિતિની વેબસાઇટ www.jacpcldce.ac.in ઉપર મુકવામાં આવેલ છે.

ખાલી પડેલ બેઠકો પર પ્રવેશ કાર્યવાહી તા. ૧૩/૧૧/૨૦૨૦ થી તા. ૩૦/૧૧/૨૦૨૦ દરમિયાન યોજાશે. ઉમેદવારે (૧) સેપ્ટ યુનિવર્સિટીના નોટીસ બોર્ડ અને વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ ખાલી બેઠકોનો અભ્યાસ કરી (૨) સ્વનિર્ભર સંસ્થા (સેપ્ટ યુનિવર્સિટી)ની ફી ને ધ્યાને રાખી સંસ્થા ખાતે સંસ્થા દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ મુજબ સેપ્ટ યુનિવર્સિટી ખાતે નિયત ફી રૂ. ૩૦૦/- રોકડા ભરીને પ્રવેશ ફોર્મ મેળવી સંસ્થા ખાતે પ્રવેશ ફોર્મ જમા કરાવવાનું રહેશે. સદર પ્રક્રિયા અર્થે બહોળી પબ્લીસિટી સંસ્થા સ્તરે કરવાની રહેશે. સંસ્થાના પ્રવેશ કાર્યક્રમ અનુસાર ઉમેદવારે સ્વખર્ચે સંસ્થા (સેપ્ટ યુનિવર્સિટી) ખાતે જવાનું રહેશે. અગાઉનો પ્રવેશ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલ પ્રવેશ રદ થતા ઉમેદવારને ફી રીફંડ', સરકારશ્રીના પ્રવેશ અંગેના જાહેરનામા ના નિયમ "Cancellation Of Admission And Refund Of Fees" પ્રમાણે થશે.

પ્રવેશ કાયમ કરાવવા માટે અસલ પ્રમાણપત્રો ચકાસણી અર્થે આવશ્યક હોઈ સાથે રાખવાના રહેશે. પ્રવેશ મળશે જ તેની કોઈ બાંહેધરી આપવામાં આવતી નથી.

વધુ વિગત તેમજ Latest Updates માટે સમિતિની વેબસાઇટ www.jacpcldce.ac.in વખતો વખત જોવા જણાવવામાં આવે છે.

તા. ૧૨/૧૧/૨૦૨૦

- મેમ્બર સેક્રેટરી